

## કોર્ટ કચેરીની મુસીબતમાં ફસાયેલા છો? તો તેમાંથી મુક્ત થવાની

### ચમત્કારિક ગુરૂચાવી

- ઝૂં ઋષિ પ્રિતેશભાઈ

આજનો માનવી એ આધુનિક યુગનો હોવાના કારણે અને કલિયુગમાં જન્મ્યો હોવાના કારણે પોતાની સહનશક્તિ ગુમાવી ચૂક્યો છે. ચારેબાજુથી ઘેરાયેલો માનવી પોતાની ઉપર આવી પડેલી તકલીફોમાંથી અને આકસ્મિક મુસીબતોમાંથી બહાર નીકળવા માટે સામ, દામ, દંડ, ભેદ વાપરતો થયો છે. આજથી પચાસ વર્ષ પહેલા દરેક મનુષ્ય કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનનાં પગથિયાં મોટામાં મોટી મુસીબત ના આવી હોય ત્યાં સુધી ચઢતો ન હતો અને જેની જોડે વિખવાદ હોય એ વ્યક્તિ સાથે સમાધાન કરી થોડું જતું કરી વાતને ભૂલી જતો હતો. જ્યારે પચાસ વર્ષ પછી આજનો માણસ નાની-નાની બાબતો કે તકલીફો જે સામસામે બેસીને ઉકેલી શકાય એમ હોય છતાં પણ એ કોર્ટ કચેરીનાં રસ્તા ઉપર ચાલે છે. એટલે ખરેખર જે માણસ સાચો હોય એ કોર્ટ કચેરીનાં લાંબા ચક્કરોમાં અટવાયેલો રહે છે અને જ્યારે એને ન્યાય મળે છે ત્યારે એનું અસ્તિત્વ પણ રહ્યું હોતું નથી. આથી કોર્ટ કચેરીમાં ચાલતી કોઈપણ પ્રકારની મુસીબતમાં કોર્ટમાં લડતી વ્યક્તિ જે સાચી હોય તેને વિજય મળે અને તેની સચ્ચાઈની જોડે ઇશ્વરીય શક્તિનાં આશીર્વાદ રહે અને સત્યનો જય થાય એવી ભાવના મારા હૃદયમાં રહેલી છે.

5 ઓક્ટોબર, 2008માં એક ભાઈ મારી પાસે આવ્યા. સમય સાંજનાં પાંચ વાગ્યાનો હતો. એમણે કહ્યું ગુરૂજી મારા બાપ દાદાની કરોડો રૂપિયાની સંપત્તિ જેમાં મારો પચાસ ટકાનો હિસ્સો છે. એ મારા મોટા ભાઈએ જે વર્ષોથી એનો વહીવટ સંભાળતા હતા એમણે પચાવી પાડી છે. 1995 થી 2000 સુધી મેં એમને પુષ્કળ સમજાવવાનો અને મનાવવાનો પ્રયત્ન કર્યો. મેં એમને ત્યાં સુધી કીધું કે મારો કાયદેસરનો પચાસ ટકાનો હિસ્સો થાય છે છતાં પણ આપ મને ચાલીસ ટકા પણ આપશો તો હું સ્વીકારી લઉંશ. તમે મારા મોટાભાઈ છો, હું તમારી જોડે કોર્ટ કચેરી કરવા માંગતો નથી. પરંતુ મારા મોટા ભાઈએ સાફ ઇનકાર કરી દીધો. છેવટે હારીને અને થાકીને મેં 2001, ફેબ્રુઆરીમાં મારી વારસાગત સંપત્તિનો હક્ક મેળવવા માટે કોર્ટ કેસ કર્યો. આઠ વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પરંતુ હજી પણ એનો ઉકેલ આવ્યો નથી અને મારી પાસે કોર્ટમાં આગળ લડવાના પૈસા પણ રહ્યા નથી. છેલ્લા આઠ વર્ષથી હું કામ ધંધો છોડીને કોર્ટનાં ચક્કર કાપી રહ્યો છું. હું ચારેબાજુથી ઘેરાઈ ગયો છું. મારી પાસે જો પૈસા હોત તો મારા મોટાભાઈ પાસેથી મારા હક્કનો હિસ્સો માંગત પણ નહિ પણ હું અત્યારે આર્થિક રીતે કંગાલ થઈ ગયો છું. ગુરૂજી મારી આ તકલીફમાંથી મને મુક્તિ અપાવો. મેં આ ભાઈની વાત સાંભળી મંત્રસાગરમાંથી મંત્રરૂપી મોતી એમને આપ્યું. મેં એમને કહ્યું આપનો પ્રોબ્લેમ થોડો જટિલ છે પરંતુ આપ નિયમિતરૂપે આ મંત્ર કરશો તો તમારા બાપ-દાદાની મિલકતમાં તમારો જ હિસ્સો છે એમાં ચોક્કસ તમને તમારો ભાગ મળી જશે. એ પછી એ ભાઈ છેલ્લા આઠ મહિનાથી મને સતત મળતા હતા. એમના પ્રોબ્લેમનું હજી કંઈ રિઝલ્ટ

આવ્યું ન હતું. એમની નિરાશા વધતી જતી હતી. પરંતુ મારા શબ્દો પર શ્રદ્ધા રાખી મંત્ર રોજ આસ્થાપૂર્વક ગણતા હતા.

જૂન, 2009 માં અચાનક એ સાંજે ચાર વાગે આવી ગયા. એમણે મને કહ્યું ગુરુજી આપના આશીર્વાદથી મારા હિસ્સાની મિલકતનું કાર્ય પરિપૂર્ણ થઇ ગયું. મેં કહ્યું કેવી રીતે? એમણે કહ્યું અમારા કુટુંબનું રાજસ્થાનમાં કુળદેવતાનું મંદિર છે. એ મંદિરનાં મહંત મોટાભાઈનાં ત્યાં અવારનવાર આવતા હોય છે. મારા મોટાભાઈ એમને ખૂબ જ માને છે. તેઓ મોટા ભાઈનાં ઘરે આવ્યા હતા અને એમણે મોટાભાઈને પહેલી વાર સમજાવ્યા કે ભાઈ-ભાઈ વચ્ચે સંપત્તિ બાબતમાં સંઘર્ષ કરીશ તો આપણા કુળદેવતા નારાજ થશે. હવે સમય પાકી ગયો છે, તું તારા નાનાભાઈને બોલાવી તેનો થતો હિસ્સો આપી દે. એમની હાજરીમાં મોટાભાઈએ મને બોલાવી ગળે લગાડીને મારો હિસ્સો આપી દીધો અને એમને અમારા બે ભાઈઓ વચ્ચે સંબંધ કરાવ્યો. અમારા કુળદેવતાનાં મંદિરનાં મહંત વર્ષમાં બે વાર મોટાભાઈનાં ઘરે આવતા હતા. પરંતુ આટલા તેર વર્ષમાં ક્યારેય આ વાત ઉચ્ચારી ન હતી અને આ મંત્ર ચાલુ કર્યાનાં આઠ મહિનામાં પહેલીવાર તેમણે ભાઈને વાત કરી અને ભાઈ માની ગયા. હું તરત જ સમજી ગયો કે આ ચમત્કાર આપે આપેલા મંત્રનો જ છે. હું આપનો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે. આપના આશિષ મારા પર સદાય રાખજો. જે લોકો કોર્ટ કચેરી કે બીજા કોઈ આવા કાયદાકીય પ્રોબ્લેમ અથવા સરકારની બીજી એજન્સીઓનો કારણ વગર ડર રહેતો હોય તેમને એમાં વિજય મળે એ માટે આ મંત્ર આપું છું.

મંત્ર: || ॐ વાજમ વાજમ કઠવત્ય સુવાલુ મુક્તિતા નમઃ ||

આ મંત્ર રોજ 61 વખત આંગળીનાં વેઢે ગણી સવારે 5 થી 8 અથવા રાત્રે 9 થી 11.30 દરમિયાન ગણીને અભિમંત્રિત જળ પી લેવું. મંત્ર ગણતા પહેલા સ્ટીલની વાડકીમાં પાણી લઈને બેસવું અને મંત્ર બોલતી વખતે જમણા હાથની અનામિકા આંગળી પાણીમાં રાખવી. જેથી પાણી અભિમંત્રિત થયું કહેવાય. આ મંત્ર સતત કરવો જ્યાં સુધી કોર્ટ કચેરીનાં પ્રશ્નનો ઉકેલ ન આવે.

|| ॐ નમઃ ||